

---

# Haritakrita Shivastavah

——  
हारीतकृतशिवस्तवः

——  
Document Information



---

Text title : Shivastava Haritakritah

File name : shivastavaHhArItakRRitaH.itx

Category : shiva, stava

Location : doc\_shiva

Transliterated by : Ruma Dewan

Proofread by : Ruma Dewan

Description/comments : vAyupurANa. ekaliNgamAhAtmyam . dashamo.adhyAyaH - uttarArdhaH -  
tIrthayAtrAphalam . 10.18-29 ..

Latest update : October 14, 2025

Send corrections to : sanskrit at cheerful dot c om

---

This text is prepared by volunteers and is to be used for personal study and research. The file is not to be copied or reposted without permission, for promotion of any website or individuals or for commercial purpose.

**Please help to maintain respect for volunteer spirit.**

---

Please note that proofreading is done using Devanagari version and other language/scripts are generated using **sanscript**.

---

October 19, 2025

*sanskritdocuments.org*

---



હારીતકૃતશિવસ્તવઃ



(એકલિંગમાહાત્મ્યે)

ૐ નમઃ શિવાય -

જયત્યખિલલોકશક્તુરઃ શિવઃ સર્વસર્વપસર્વદપ્રણાતજનપશુપાશપટલ-  
પાટનલમ્પટપ્રસાદશીલતાલક્ષ્મીશરીરઃ, દક્ષદક્ષમખમથનધાતુમુખકુહનિર્ઝર-  
દખિલવેદવિદ્યાસુરસરિજજાત્કારમુખરિતત્રિદશકુલશૈલરાજઃ, માલતીમલ-  
યમન્દારકુટજકુન્દકદમ્બોન્મત્તકેતકીકલ્હારકર્પૂરપારિજાતકમધુરમધુકર-  
કનકચમ્પકમલ્લિકાભિલ્વપત્રપાટલીશતપત્રિકાર્કકિંશુકબકુલકમલકર્ણિ-  
કારત્રિસન્ધ્યાગસ્ત્યબર્બરિકાકલ્હોલકાગ્ન્યનારકરવીરાગરુ-શ્રીખણ્ડયક્ષકર્દ-  
મલિમાડગશરીરઃ, સતતસંયુક્તકિન્નરકામિનીભૃંગ(વૃન્દ)ગીતનૃત્યવંશવાદ્ય-  
વીણાવેદધ્વનિભરિતભુવનકૈલાશશિખરશિખરાગ્રશૈલરાજઃ, પગ્ચાર્થતીર્થર-  
તરતિભુવનરતિતૃમયોગ-યોગદયોગિનિર્વાણદઃ, પાર્વતીનખપ્રણચિહ્નિત-  
શરીરનિર્મલનિષ્કલનિષ્કલકુઃ, વિષવિષમવિષયમૃત્યુમકરકુલાકુલાન્દોલિ-  
તકલિજલજરાસ્ફીતકૃનજન્મોર્મિમાલાસંસારસાગરસમુત્તરલૈકપોતઃ, સદ-  
સદુત્પત્તિપાલનવિલયકારણધરાધષ્ટનુપરિપાલિતજગત્ત્રિતયસકલસુરાસુર-  
કરાકર્ષણજનિતજવમન્દરપરિવર્તિતઘોરાઘાતનિર્મથિતદુઘોદધિજાતકાલ-  
કૂટચટુલાનલકવલેનકૃષ્ણકણ્ઠઃ શ્રીકણ્ઠઃ, બ્રહ્મચક્રલબ્ધલિંગાવસાનપરિ-  
પૂર્ણઃ, પરિતૃપ્તદશવદનપ્રચણ્ડોર્દણ્ડમણ્ડપોત્કલિતકૈલાશશૃંગચલન-  
ભયચકિતરણરણિતરમણીયમણિખચિતકનકનૂપુરમધુરવમુખરિત  
ચરણકમલઃગૌરીકુચકલશકુલ્લુમપદ્મલાઞ્છિતશરીરઃ, વિપુલપીનાડગઃ  
શશિશેખરઃ શિવઃ શાન્તઃ શાશ્વતઃ, હરિકરખરનખરસમૂહતીવ્રકિરણપટ-  
લાટ્ટાટ્ટહાસભાસુરકરતલચપેટાપાટિતવિકટકરિકુમ્ભસ્થલોચ્છલિતવિમલ-  
મુક્તાકૃલખચિતહરિનારીચર્મવિચિત્રનિતમ્બભિમ્બઃ, પ્રણાતશચીપતિકર્ણપૂર-  
પલ્લવોલ્લિખિતપાદપીઠઃ, કણ્ઠોલ્લુઠિતકપાલમાલાભરણભૂષિતશરીરઃ,  
જન્મજરામરણભયવર્જિતઃ, ચમ્બકો બકુલકુસુમસુરભિતમણિશિલાતલસ-  
મુલ્લસિતવિમલજલવિલુલિતકલહંસમધુરધ્વનનિર્મલયોનિમધુમથનમધુર-

सामध्वनिसंस्तूयमानः, सञ्जनन्दोऽतिबलोऽपिमादिसिद्धिगुणनिधानः,  
 प्रजातजनवत्सलप्रलयजलदतडिदंशुद्धर्धरघगधगितनिर्गतकिरणश्रेणिपिशुङ्गि-  
 तवरललाटलोक्यनोच्छलव्यटुलशिभानिर्दग्धमकरध्वजशरीरः, उरो निभि-  
 लदुःखडरस्त्रिदशशेपरः, क्षरज्जलक(य)यकवालकवलितसकलद्विग्वल-  
 यशूलनिर्भिन्नदुर्धरा-धकमडासुरः प्रमथनाथः, सप्तलोकेश्वरप्रवरपिनाकमु-  
 क्तैकशरनिर्गतविषयविशिभशिभासितप्रतापताप्यमानदनुजैन्द्रकर्णपूरभुज-  
 युगलभस्मीकृतत्रिपुरत्रितयः, रुद्रो रौद्रो रौद्रभूताट्टसङ्ग्रामलम्पटनिशितनि-  
 स्त्रिशशूलपरशुपाशाङ्कुशाशनिशक्तितूपातोमरभल्लिकार्णालिकनारायशर-  
 शाङ्गयकगदावजमुद्गरदण्डभिन्दिपाललमुसलशम्भलभङ्ग(य)हुरिका-  
 कर्तरीकुलापकुन्तकलकङ्कलिकाभुशुर्शीशुङ्कुटपस्त्रिधपट्टिशप्रभृतिवरायु-  
 धधरः, उदतपटुपटुदतटितभधिरितगगनगमनदुर्लवितसकलसुरासुरमौलि-  
 लीनयरणकमललीलालसाङ्गुलीतलनिर्दलितदशवदनमुभासुरसेवितविकट-  
 डिरीटकोटीरभारः, वलिताङ्गभुजङ्गाभरणो भवो भव्यो भाव्यो भूतेशो  
 विभवप्रदो भवार्तिउरो विशुद्धवदनो भुजङ्गमणिविस्फूर्जितदृढयः,  
 कालकालमडाकालानलकर्णपूरशिरोमणिः, कपालमालाभण्डमण्डितजटाजू-  
 टडरिभलवदनकालकूटलेभोद्धटनाडितकण्ठैकदेशः, श्मशानभस्मोद्धृतस-  
 कलवित्राडो उरीकृतमडाभुजङ्गः, कपिलकृतसकलवित्राडो वित्राडुर्धनारी-  
 धरो भैरवमडाभैरवभैरववैतालमातृपरिवृतः, शुभदशनमुभमयूभभयित-  
 उसितदीप्तिविदलितबहुलान्धकारः पितृवनसमारब्धताण्डव प्रसारितभुज-  
 सडस्रदुर्निरीक्षिताकाण्डभ्रमाण्डमण्डपो वरो वरपरशुधरः, परापरः पवित्रः  
 पवमानःपवनकम्पितकनकयम्पकलतापतितकुसुमधूलिधवलितत्रिशूलपृथु-  
 डैलाशगिरिकन्दरनिवासः, शरणध्यानदज्ञानदमोक्षदः, शुद्धस्फुटिकमणि-  
 सङ्घशुभदण्डः, उभयधामधवलितसकलभुवनान्तरालः, शशिकोटीविघटन-  
 विकटकिरीटकोटीरभारः, सजलजलदजलशुद्धज्ञानैकतत्त्वकठिनपापानङ्गा-  
 ङ्कुट्टनाङ्कुण्डितकुडारः, सुरकरिकपोलामलविगलितबहुलसमुज्ज्वलगन्ध-  
 लुब्धमधुपपदलितकनकपङ्कजशःपुञ्जपिञ्जरितगगनगमनमन्दाडिनीप्र-  
 वाडप्रोक्षिततृतीयनयनः, पाञ्चजन्यकुटिलाङ्कुलोचनवरवरवृषभस्कन्धरतः,  
 गजासुरकृत्तिवसनो बाणसुररिपुर्दण्डनाशनः, तत्त्वदृष्टिमागानुरतः,  
 क्षुभितलक्ष्मीकरकमलान्दोलितोद्गमभेभमणिमयदण्डमण्डितयारुयामर-  
 मरुद्वीजितयरणशतपत्रः, सत्यासत्यवृत्तः, त्रिभुवनैकनाथप्रभुः ।

श्रीमद्रेकलिङ्गदेव भक्तजनोपशुव्यमानमोक्षाधनन्तकल्पपादप, अभि-

લલિતનીલોન્મીલિતસાન્દ્રમન્દારકુડ્મલોદ્દામહેમમકરન્દપાનમદિરામત્તષ-  
 ટ્પદકુલસન્દોહસુન્દરસુન્દરીઝહુારભૂષિતાદ્ગ્નિતામરસયુગલાવ્યયાક્ષયબ્રહ્મ-  
 પ્રાજાપત્યદ ! વિષ્ણુચક્રદ ! ઇન્દ્રરાજ્યદ ! વજ્રિવજ્રદ ! નન્દિગણાધિપત્યદ !  
 ઉપમન્યુક્ષીરોદધિદુગ્ધદ ! નરકોદધિમુલ્યમાનાસિપત્રવનસમુત્તરણૈકપ્રસાદ-  
 પોત ! યમનીતિકાલકૂટ ! જનનીજનજીવિતૈશ્વર્યન્દઃ(દ) શકુન્કર્ણન્ધનદકમ-  
 લજશક્રચક્રધરપ્રમુખસુરાસુરસૈવિતમન્દિરદ્વારઃ(ર) ત્રિવિષ્ટપ્રકટાટન-  
 વિજયકરણકૃષ્ણરુદ્ધિમાણીયુક્તરથગમનતુહિનપર્વતનિતમ્બબિમ્બચુમ્બિતસુર-  
 સરિદમ્બુપ્રવાહધારાધૌતધવલોપલતમોપવિષ્ટમુનિજનવિશુદ્ધધ્યાનસન્તાનપૂ-  
 જિતદત્તભૈરવહસ્તાવલમ્બનઃ(ન) ભૈરવરૂપ સન્નાસિતાસુરગણઃ(ણ)  
 અવજ્ઞાલસવામકરાડ્ગુષ્ઠનખનિકૃન્તિતપિતામહપગ્ચમશિરઃકમલઃ(લ)  
 શરભવચ્ચચુનાખમુખાહતરુષિતનરસિંહવિગ્રહઃ(હ) વિગ્રહાર્ધુનારીધરઃ(ર)  
 પૂષ્ણોઃ દશનપાતનઃ(ન) પાતિતકૃષ્ણકેશસ્તમ્બિતવજ્રિવજ્રઃ(જ)  
 બાહુલેયસનત્સુમારયોગાપહારકારકઃ(ક) તીવ્રતરણિકિરણનિવહવિકસિ-  
 તકમલદલવિપુલનયનઃ(ન) શશિકરનિકરવર્ષશતશકુન્કર્ણઃ(ર્ણ)  
 હારીતઋષિશોકાનલહરો(ર) હર નમસ્તે હર નમસ્તે હર નમસ્તે ।

ઇતિ એકલિડ્ગમાહાત્મ્યે હારીતકૃતશિવસ્તવઃ સમ્પૂર્ણઃ ।

- ॥ એકલિડ્ગમાહાત્મ્યમ્ । દશમોઽધ્યાયઃ - ઉત્તરાર્ધઃ - તીર્થયાત્રાકૃલમ્ । ૧૦.૧૮-૨૯ ॥

- .. ekali NgamAhAtmyam . dashamo.adhyAyaH - uttarArdhaH - tIrthayAtrAphalam .  
 10.18-29 ..

Notes:

Caṇḍa ચણ્ડ and Nandī નન્દી, who had previously been cursed by The Devī દેવી towards a human birth, traversed around in KaliYuga કલિયુગ on the Pṛthvī પૃથ્વી as Hārīta Muniહારીત મુનિ and Bāṣpa Rājā બાષ્પ રાજા. They spent their time in worshipping Maheśvara મહેશ્વર and Devī Vindhyaṁvāsā દેવી વિન્ધ્યવાસા.

Devī Vindhyaṁvāsā દેવી વિન્ધ્યવાસા Grants a Boon to Hārīta Muniહારીત મુનિ that his speech will be a mix of Gadya-Padya ગદ્ય-પદ્ય (i.e. Prose-Poetry) and advised him to thus eulogize Śiva શિવ.

The Hārītakṛta ŚivaStavaḥ હારીતકૃત શિવસ્તવઃ thus has initial 6 Padya પદ્ય (Stanzas / Verses) and latter part is a long Gadya ગદ્ય (Prose).

Pleased with his eulogy, Ekaliṅga Śiva એકલિઙ્ગ શિવ grants respectively sought boons to Hārīta Muniહારીત મુનિ and Bāṣpa Rājā બાષ્પ રાજા. Hārīta Muniહારીત મુનિ accompanies Śiva શિવ to His Abode; while, Bāṣpa Rājā બાષ્પ રાજા stays in Medapāṭa મેદપાટ - Citrakūṭa ચિત્રકૂટ, protected by Rāṣṭrasenā રાષ્ટ્રસેના.

In present times, Medapāṭa મેદપાટ and Citrakūṭa ચિત્રકૂટ are known as Mevāra (Mewar) મેવાડ and Cittauragaṛha (Chittorgarh) ચિતૌડગઢ respectively.

EkaliṅgaMāhātmyam એકલિઙ્ગમાહાત્મ્યમ્, that constitutes a SthalaPurāna સ્થલપુરાણ and SthalaMāhātmyam સ્થલમાહાત્મ્યમ્, has been composed in two styles - Paurāṇika પૌરાણિક and Kāvyaṁaya કાવ્યમય. It includes the descriptions about the manifestation of the Ekaliṅga Śiva Kṣetra એકલિઙ્ગ શિવ ક્ષેત્ર in relation to the story of the duo - Bāṣpa Rājā બાષ્પ રાજા - Hārīta Muni હારીત મુનિ, and the lineage of kings of Citrakūṭa ચિત્રકૂટ (now k.a. Cittauragaṛha ચિતૌડગઢ) and Medapāṭa મેદપાટ (now k.a. Mevāra મેવાડ) including Mahārāṇa Kumbhā મહારાણા કુમ્ભા.

Bāṣpa Rājā બાષ્પ રાજા is now popularly known as Bappā Rāvala બપ્પા રાવલ.

The VāyuPurāṇam વાયુપુરાણમ્ has been attributed to be the source composition of EkaliṅgaMāhātmyam એકલિઙ્ગમાહાત્મ્યમ્ as the main narrator of the same is Vāyu વાયુ.

EkaliṅgaMāhātmyam - Paurāṇika એકલિઙ્ગમાહાત્મ્યમ્ - પૌરાણિક is composed in 32 chapters that, with a brief summary of each chapter; and the EkaliṅgaMāhātmyam - Kāvyaṁaya એકલિઙ્ગમાહાત્મ્યમ્ - કાવ્યમયમ્ can be accessed from the respective links given below.

EkaliṅgaMāhātmyam - Kāvyaṁaya એકલિઙ્ગમાહાત્મ્યમ્ - કાવ્યમયમ્ includes description of the lineage of Bāṣpa Rājā બાષ્પ રાજા, Stuti સ્તુતિ of the erudite Mahārāṇa Kumbhā મહારાણા કુમ્ભા i.e. Kumbhakarāṇa કુમ્ભકરણ, and the Pañcāyatana Stuti પચ્ચાયતન સ્તુતિ. The latter comprises of Stuti-s of Ganeśa ગણેશ, Sūrya સૂર્ય, Nārāyaṇa નારાયણ, Śiva શિવ, Caṇḍikā ચણ્ડિકા and Ekaliṅga Śiva એકલિઙ્ગ શિવ.

It is noteworthy that the Pañcāyatana Stuti પચ્ચાયતન સ્તુતિ has some names associated with Kumbhā કુમ્ભા such that he is remembered with each of the Deity worshipped with this stuti. Towards conclusion, there is EkaliṅgaNamaskāra એકલિઙ્ગનમસ્કાર.

Encoded and proofread by Ruma Dewan

*Haritakrita Shivastavah*

pdf was typeset on October 19, 2025

Please send corrections to [sanskrit@cheerful.com](mailto:sanskrit@cheerful.com)

